



Diabetes Education Forum

ડાયબેટીસમા પગાની સંલાલ

મધુમેહ જ્ઞાનપ્રસારણ મંચમાટે

ડા. પ્રદીપ તળવલકર

મધુમેહ તફા

ફોન : ૨૪૩૬૨૨૭૪ મોબા. ૯૮૨૦૨૮૭૮૦૬

પગાની સંભાળ

પગાની સંભાળ

સામાન્ય વ્યક્તિત્વ કરતા, મધુમેહી વ્યક્તિત્વને - ખાસ કરીને જેમને દીધી કાળથી મધુમેહ છે અને કાબુમાં રહેતો નથી એમના પગામાં ઘણી સમસ્યાઓ ઉદ્ભવે છે. દા.ત. પર થવુ, પગ સડી જવો, જખમ ન ભરવી વગેરે. આની પાછળના કારણો નીચે પ્રમાણે છે.

- ૧) પગાને લોહી પહોંથાડનાર રક્તવાહીની પર અથેરોસ્ક્લેરોસીસ ની અસરથી લોહીનો પૂરવઠો ઓછો થાય છે.
- ૨) મજજજાતંતુ પર અસર થઈ સંવેદનશીલતા ઓછી થાય છે.
- ૩) આ વ્યક્તિત્વ જંતુપ્રાદુર્ભાવના ભોગ જલદી બને છે.

મોટે ભાગો આ ત્રૈણો કારણો એકત્રિતપણે ઉપર દર્શાવેલી બધી સમસ્યા નિર્માણ કરે છે. પગાની સમસ્યા ટાળવાના દાઢીકોણાથી મધુમેહી વ્યક્તિત્વે પગાની જીવથી પણ વધુ સંભાળ લેવી જોઇએ. જે પ્રમાણે કોઈ ગાયક પોતાના ગળાની સંભાળ રાખે, વાદક પોતાની આંગળી અને અભિનેત્રી પોતાનો ચહેરો અથવા તો હીરાનો વેપારી હીરા સંભાળે એવીજ રીતે મન દેઇને લીધેલી પગાની સંભાળ એટલીજ મહિત્વની છે. પગાને જખમ થાય કે ગુમડુ થાય તો તત્કાળ એની ઉપાયયોજના કરવી અત્યંત મહિત્વનું છે.

મધુમેહી વ્યક્તિત્વ પોતાના પગાની કાળજી ન લે તો ધીરે ધીરે નાની સમસ્યાઓમાંથી પગ સડીને કાપવો પડે એટલી હૃદસુધી વાત પહોંચી જાય છે. પગ સડવાની શક્યતા મધુમેહી વ્યક્તિત્વમાં સામાન્ય વ્યક્તિત્વ કરતા ૧૭ ગણી વધારે હોય છે. આ બધી સમસ્યા ન ઉદ્ભવે એ માટે મધુમેહી વ્યક્તિત્વે નીચેની બાબતો નિત્ય આચરણમાં લાવવી.

- ૧) દિવસમાં બે વખત પગ સૌભ્ય સાખુ અને હુંફાળા પાણીથી (ગારમ નહીં) ધોવા.
- ૨) એ આંગળી વરયેની જગ્યા નરમ કપડાથી સૂકી કરવી.

- ૩) ચામડી સૂકાઈ જતી હોય તો કોપરાનું તેલ, વેસેલીન કે કોડ ફીમ સૂતા પહેલા લગાડવું.
- ૪) પગના નખ સરખી રીતે કાપેલા હોવા જોઈએ. નખ હમેશા સીધા કાપવા. ચામડીની નજ્દકથી નહીં કાપવા.
- ૫) રોજ પગની દેખભાલ રાખવી. કોઈ જખમ ફોડ કે ગુમડુ દેખાય તો ડાક્ટર સાથે સંપર્ક સાધવો.
- ૬) પગારખા વગાર ન ચાલવું (ઘરમાં પણ).
- ૭) પગની સંવેદના ઓછી થવાની શક્યતાને કારણે વધારે ગરમ પાણીથી શોક ન કરવો.
- ૮) પગની આંગળીઓને સંરક્ષણ આપવા પહોળા અને નરમ કંણવાસના કે ચામડાના બૃટ પહેરવા.
- ૯) નવા બૃટ શાંખાતમાં રોજ થોડો સમયજ વાપરીને પછી ધીમે ધીમે એની ટેવ પાડવી. નવા બૃટ હંમેશા સાંજે ખરીદવા.
- ૧૦) પગમાં કાંટનના મોજા પહેરવા. બહુ ઘટટ (ટાઇટ) ઈલાસ્ટીકવાળા મોજા ન વાપરવા. એનાથી પગમાં લોહીનું અભિસરણ બરાબર થશે નહીં.
- ૧૧) રોજ બૃટ તપાસવા (ખીલા, નખ, કાંકરી વગેરે માટે).
- ૧૨) પગમાં કૉર્ન (ભોવરી) થાય કે ચામડી જાડી થાય તો જાતે ન કાપવી. ડાક્ટરને બતાવવું.
- ૧૩) પગને પ્રખર કેમીકલ્સ ન લગાડવા.
- ૧૪) તમાકુન ખાવી.
- ૧૫) નિયમિત વ્યાયામથી રકતાભિસપણ વધે છે એટલે પગના વ્યાયામ નિયમિત કરવા. બેઠા હોય ત્યાં સામે ખુરસી મૂકીને એની પર પગ લાંબા કરો અને દિવસમાં ૨ થી ૩ વખત પાંચ મિનીટ પગના બધા આંગળા ઉપરનીયે કરો એજ પ્રમાણે પગલા ઉપરનીયે અને અંદર બહાર ફેરવો.

જખમ કે પગ પર સોજો ઉત્તરતો ન હોય તો નીચે પ્રમાણો કાળજુ લો.

જખમ સૌભ્ય સેવલાન અથવા ડેટાલથી સાફ્ કરો.

જખમ પર જંતુરહીત કરેલા ગોঁડ અને જંતુનાશક મલમથી પટટી બાંધો. લોહીમાં સાકરનું પ્રમાણ કેટલું છે એની તપાસ તાબડતોબ કરો. જખમ થયેલો પગ બીજો થવા નહીં દેવો. ન્હાતી વખતે પગ પ્લાસ્ટિકની થેલીથી બાંધો અને એમ જલ્દી ડાંકટરનો સંપર્ક સાધો.

મધુમેહી દરદીએ પગ પર શાસ્ત્રકિયા થયી પછી લેવાની કાળજુ

પગ પર વજન આવવા દેશો નહીં. જખમ ઉપર ચાલવાથી પગ ગુમાવવાની શક્યતા આવી શકે.

પગ બીગો થવા દેવો નહીં.

માખી અને બીજા જંતુ બેસે નહીં એ માટે ફ્રેસિંગ ઉપર પ્લાસ્ટિકની થેલી બાંધો.

જખમપર ડાયરેક્ટ કાપૂસ રાખવો નહીં.

હરરોજ ડાક્ટરની સલાહ પ્રમાણો મલમપટટી કરો.

યોગ્ય આહાર લેવો અને લોહીમાંની સાકર કાબુમાં રાખવી.

ફ્રેસિંગ કરવાની પદ્ધત

- જખમ હળવેથી જંતુરહીત કરેલા ગોঁડ અને સૌભ્ય સેવલોનથી સાફ્ કરો. જંતુરહીત ગોঁડથી જખમ સુકી કરો.
- એની ઉપર એન્સામાયસીન કીમ લગાડો.
- જંતુરહીત પેંડ અને કેપ બેંડેજ વાપરો.
- ફ્રેસિંગમાટે વપરાયેલા દવ્ય કે મલમ જખમની બાજુની સારી ત્વચાને અડે નહીં એની કાળજુ લો.
- કેપ બેંડેજ ઘૃટણાસુધી બાંધો.
- ફ્રેસિંગ કરતી વખતે જંતુરહીત કરેલા હાથમોજા વાપરો.